


ડૉ. લિલા કે. શાહ  
માસ. મેન. (ઓફિ)  
અદ્યાત્મા

ડૉ. લિલા કે. શાહ  
માસ. મેન. (ઓફિ)  
અદ્યાત્મા

## ઇન્ડ્રપુરી હોસ્પિટલ

ઓ આ સ્વા પારોડીય રોક, પડોદા.  
ફોન: ૭૯૪૩૧૦/૭૯૪૩૧૧  
સમય: ૧૧.૦૦ બી ૧.૦૦ બી ૮.૦૦  
માર્ગનામી ૧૪ ડેસ્ટિને



## કમર ને ઉપયોગી કસરતો

### કસરત-૧

- છતા સુઈ ધૂટકુણ વાળાં, પંજાને જમીનને અડાડી રાખવા ઉડો થાસ લઈ અને છાંદાં. - ન્યાર પછી એક ધૂટકુણને બંને હાથ વડે છાતી પર લઈ જવા, પછી નેં કરીશી વાળેદી સિયટિમાં દર્દ જ્વા આજ વસ્તુ બીજી પગ માટે કરવી.
- સીધા સુઈ ધૂટકુણ વાળી બતે પંજાને જમીનને સીધા અડાડવા ઉડો થાસ લઈ અને છાંદાં. ન્યાર પછી બતે પગને ધૂટકુણેથી વધારે વાળી છાતાં તરફ લાવવા ત થી પ સેકન્ડ એ સિયટિમાં રહેતું પછી આગળની સિયટિમાં આવવું અને ત્યારબાદ બતે પગને સીધા કરી આડામ કરવા.

### કસરત-૨

- છતા સુઈ ધૂટકુણ વાળી, પંજાને જમીનપર સીધા ટેકવી ઉડો થાસ લઈ અને છોડવા. ત્યાર બાદ એક પગને ધૂટકુણેથી વાળી છાતી તરફ લેવો. અને ત્યારબાદ પગને ધૂટકુણેથી સીધા કરી ઉચ્ચા કરવા. ૨ થી ૫ સેકન્ડ એ પગને ઉપર રાખી થીરે રહીને વાળી અને પછી મૂળ સિયટિ પર આવવું.




### કસરત-૩



- છતાં સુઈ પગ વાળી બતે હાથ વાળી ગળાને ટેકો આપવો પંજાને છતા ટેકવી ઉડો થાસ લેવો અને છોડવો. થીરે રહીને પેટના સ્થાપુંઝને ટાઈટ કરી કમર નીચે દબાવી થાપાના ભાગેથી થોડા ઉચ્ચા થતું, એકદમ વધારે પડતાં ઉચ્ચા ન થતું. આ સિયટિમાં ૫ થી ૬ સેકન્ડ રહીને થાપાના ભાગ તથા પેટના ભાગ રીલેક્સ કરી મૂળ સિયટિમાં આવી જતું.


### કસરત-૪



- દીવાલને ટેકવી છતા ઉચ્ચા રહી એક લાથના અંગુઠાથી બીજી હાથને પકડી કમરની પાછળના ભાગમાં રાખી જમીન તરફ ખલા તથા હાથને બેંચવા ત્યાર બાદ પંજા ઉપર અંગળી ઉપર ઉચ્ચા થતું. અને થીરે થીરે ગળાના ભાગેથી છત તરફ જોઈ શરીરના ઉપરના ભાગે ઉપર બેંચવો અને બંને હાથને ખખા વડે નીચે બેંચવો ત થી ૧૦ વખત આમ રીપીટ કરવું. તેજ રીતે બંને હાથને ઉપર તરફ રાખી એક અંગુઠાને બીજી હાથેથી પકડી તેને ઉપર બેંચવા અને પંજાના ભાગમાં થીરે રહીને ઉચ્ચા રહેવું.

### કસરત-૫

- સુતાં બંને પગને સીધા રાખી પંજાને બેંચી રાખવા ત્યાર પછી ધૂટકુણને વાળ્યા વગર કોઈપણ એક પગ થીરે થીરે જ્યાં સુધી કમરમાં દુખાવો ન થાય ત્યા સુધી ઉપર લઈ જવો ૨ થી ૩ સેકન્ડ તંત સિયટિમાં રાખી થીરે રહીને પગ નીચે મુકવો. ૫ થી ૬ વખત બંને પગને વારાકરતી આ રીતે ઉચ્ચા નીચા કરવા.



### કસરત-૬

- પેટ ઉપર ઉચ્ચા સુઈ બંને હાથ વડે પાછળ રાખી પગ તરફ બેંચી પાછળ રાખી ખખાથી થોડા ઉચ્ચા થઈ નીચા થતું અને માથાના ભાગને જમીન થી થોડા ઉચ્ચા કરવા ઉડો થાસ લઈ ૨ થી ૫ સેકન્ડ રાખી થીરે રહીને થાસ છોડી આરામની સિયટિમાં આવવું.

### કસરત-૭

- ખુરથી તથા ટેબલના એક ભાગને પકડી કમરથી વાળ્યા વગર ધૂટકુણેથી વાળો થીરે રહીને ઉચ્ચા થતું અને બેસથતું આકિયા ૭ થી ૧૦ વખત કરવી અને ત્યાર પછી દીવાલને ટેકવી ૨ થી ૩ મીનીટ કમરના ભાગને ઢીલા કરવા પ્રયત્ન કરવો.



ડૉ. લિલા કે. શાહ  
માસ. મેન. (ઓફિ)  
અદ્યાત્મા

ડૉ. લિલા કે. શાહ  
માસ. મેન. (ઓફિ)  
અદ્યાત્મા

ડૉ. રીના એળ. શાહ  
માસ. મેન. (ઓફિ)  
અદ્યાત્મા

## ઇન્ડ્રપુરી હોસ્પિટલ

ઓ આ સ્વા પારોડીય રોક, પડોદા.  
ફોન: ૮૫૧૬૧૫૧/૮૫૧૫૬૮૮  
સમય: ૧૧.૦૦ બી ૧.૦૦ બી ૮.૦૦  
માર્ગનામી ૧૪ ડેસ્ટિને

ડૉ. રીના એળ. શાહ  
માસ. મેન. (ઓફિ)  
અદ્યાત્મા

## ઇન્ડ્રાપુરી હોસ્પિટલ

દ્વારા ચાર રસ્તા યાદોકીલા રોડ, વડોદરા.  
ફોન : ૯૮૨૫૦૪૫૧/૯૮૨૫૦૬૮૨  
સમય : ૧૧.૦૦ વિં ૧.૦૦ અને ૫.૦૦ વિં ૮.૦૦  
ઈમેઇલ : ૯૮૨૫૦૪ ૪૪૩૦૧




ઘુંઠા ઉપર નેસી, હાથ ઉંચા કરી, ઉંદો ખાસ લઈ થીરે થીરે  
આગળ નમતું. પછી ૧૦ સુધી ગણતું પછી થીરે થીરે ઉભા થતું.

કસરત-૬



ઘતા સુઈ પગન હો તિંદી ઘુંઠદ્વારી વાળી ડાંને અને  
જમણી બાજુ થાપા અને પગના ભાગને વાળના દરેક  
વખતે ૧૦ સુધી નસતું.

કસરત-૧૦



ઘોડા જેવી પોઝિશન લઈ ડાબો હાથ અને જમણો પગ ઉંચા  
કરવા. અને ૧૦ સુધી ગણતું. ત્યારપછી જમણો હાથ અને  
ડાબો પગ ઉંચા કરી ૧૦ સુધી ગણતું.

કસરત-૧૨



ઉંધા સુઈ હાથના ભાગને માથાથી આગળ કરી થીરેથી માથાનો ભાગ  
ઉંચો કરવો અને ૧૦ સુધી ગણતું.

કસરત-૧૧



ચતા સુઈ પગ સમાન્ય વાળી હાથ છાતી ઉપર મુકી  
થીરેથી આગળ તરફ નમવાનો પ્રયત્ન કરવો અને ૧૦ વિં  
૧૫ સુધી ગણતું.

કસરત-૧૩



જમણા પગ ઉપર ઉભા રહી ડાબા પગને એક કુટ ઉંચા ટેબલ  
ઉપર મુકો. પછી જમણા પગને થીરેથી સીધો કરી પાછળના  
ભાગે ખેંચો અને ૧૦ સુધી જગો. આવી જ રીતે ડાબા પગથી  
કસરત કરવી.

### ાટલું ખાસ દ્વારાનમાં રાખો :-

### ૭ કમર દુઃખે છે.

- વાંકા વળતું નહીં.
- સીધી પથારીમાં ગાઢલુ રાખી આરામ કરવો.
- વજન ઉપાડતું નહીં.
- પગમાં દુખાવો આવે તો ડૉક્ટરની સલાહ લેવી

- |  |
|--|
| ● દરેક કસરત ૫/૧૦/૧૫/૨૦/૨૫ વખત કરવી.    |
| ● દરેક વખતે ૫ થી ૧૦ ગણો અને પાછું કરો. |
| ● દિવસના ૨/૩/૪/૫ વખત કસરત કરવી.        |

# કુમરની કાળજી માટેની અગત્યની સુચનાઓ

## ફીજીયોથેરાપીસ્ટના માર્ગદર્શન આધારીત અગત્યની કુમરની કાળજી માટેની અગત્યની કસરતો

### કસરત ૧ દીવાલ આધારીત કસરત

તમારી પીઠ દીવાલને ટેકવીને ઊભા રહો અને પગ તમારા જલા જેટલા પહોળા રાખો.  
ધીમે ધીમે નીચે સરકો, એ માટે ધૂંટણને લગભગ 90 અંશ સુધી વાળો.  
પાંચ સુધી ગણો અને દીવાલના આધારે સરકીને ઊભા થાઓ. આ કસરત 5 વાર કરો.



### કસરત ૨ પગ લોલક કસરત

પુરુષી પાછળ ઊભા રહો અને તમારા હાથખુરણીની પીઠ પર રાખો. એક પગ ઊંચો કરીને પાછળ  
લઈ જાઓ અને ઊંચો કરો. એ વખતે ધૂંટણ સીધો રાખો. ધીમેધીમે પગને પાછો પૂર્વ સ્થિતિમાં લાવો.  
પછી બીજો પગ ઊંચો કરો. દરેક પગ માટે આ કસરત પાંચ વખત કરો.



### કસરત ૩ છાતી પર ધૂંટણ કસરત

કઠણ સપાટી પર ચચ્ચા સુઈ જાઓ. તમારી હૃદૈનીઓને સાથણ ફરતે વીટાણો  
અને તેને તમારી છાતી તરફ મેંચો. એ વખતે બીજા પગને જમીન પર સીધો રાખો.  
આ સ્થિતિમાં 3 સેકન્ડ રહો, બીજા પગની કસરત કરો. પાંચ વખત કસરત કરો.



### કસરત ૪ પેટ વ્યાયામ કસરત

પથારીમાં ચચ્ચા સુઈ જાઓ અને ધૂંટણ વાળો અને ચરાણ સીધાં રાખો. તમારા બંને ધૂંટણને  
તમારી છાતી તરફ ઊંચા કરો. બંને હૃદૈનીને તમારા ધૂંટણ નીચે રાખો અને તમારા ધૂંટણને શક્ય  
એટલા છાતી તરફ લાવો. તમારું માયું ઊંચું ન કરશો. તમે તમારા પગ નીચે લાવો ત્યારે  
અને સીધાં ન કરશો. આ કસરત પાંચ વાર કરો.



### કસરત ૫ છાતી-ધૂંટણ વ્યાયામ આધારીત કસરત

જમીન પર ચચ્ચા સુઈ જાઓ અને ધૂંટણ વાળો. તમારી પીઠ જમીન પર સપાટ રાખો. એ માટે તમારા પેટના  
સ્નાયુઓને ઉપર-નીચે મેંચો. તમારો પગ ઊંચો કરો, એ વખતે ધૂંટણ સીધો રાખો. ત્રણ સેકન્ડ જાળવો.  
ધીમેધીમે પગ જમીન પર લાવો. આ કસરત બીજા પગ માટે કરો. તમારો કટિપદેશને ફણેલો રાખો  
અને દરેક વખતે બીજા પગને ઢીલો રાખો. તમારો આસ રોકશો નહીં.



### કસરત ૬ કટિફાળ આધારીત કસરત

તમારી કમરણા નીચેના લાગને જમીનાપર રાખો. એ માટે પેટના નીચેના સ્નાયુઓને  
ઉપર-નીચે કરો. તમારી પીઠ સપાટ રાખો અને આ સ્થિતિ ત્રણ સેકન્ડ માટે જાળવો.  
એ વખતે હળવેથી આસ લો અને છોડો. તમારો આસ રોકશો નહીં.  
આ કસરત પાંચ વાર કરો.



## કસરત ૭ નિતંબાસન

તમારા નંબે ઘૂંટણા વાળો, ચરણને જમીન પર રાજો. અદબ જાળવો.  
તમારું માથું (ગરદન) જમણી તરફ વાળો. એ વખતે ઘૂંટણને કાબી બાજુએ ફેરવો.  
ઘૂંટણને ઢીલા રાજીને નીચે લાવો. ઘૂંટણને પાછા ઊર્ચા કરો. માથું વચ્ચમાં રાજો.  
દિશા બદલો. આ કસરત પંચ વાર કરો.




## કસરત ૮ પગબળ આધારીત કસરત

તમારા પેટ પર સૂર્ય જાઓ. એક પગના રણાયુ કઢું કરો અને જમીન પરથી ઊર્ચો કરો.  
તમારો પગ ઊર્ચો રાજીને 5 સુધી ગણો અને પાછો જમીન પર લાવો.  
બીજા પગ માટે પણ આમ કરો. દરેક પગ માટે પાંચ વખત કસરત કરો.



## કસરત ૯ હાથ-કોણી આધારીત કસરત

તમારા ઘૂંટણા અને કોણી જમીન પર રાજીને વાંકા વળો. તમારા નિતંબને તમારી પાની પર, જમીનની સમાંતરે રાજો. તમારા શરીરના ઉપલા ભાગને એવી રીતે ઊર્ચો કરો કે તમે ભાજોડિયા જેર રહો અને તમારા હાથને તમારી સામે લંબાવો.  
આ સ્થિતિમાં ઢીલાશ રાજો અને પછી તમારી કોણીને સીધી કરીને આગળ વધો.  
અને પ્રેસ-અપ સ્થિતિમાં રહો. આ કસરત પાંચ વાર કરો.



## કસરત ૧૦ દંડાકાર

તમારા હાથસીધા કરો, તમારા ઉપલા અંગને ઊર્ચું કરો. તમારા કટિપ્રેશનને જમીન પર રાજો.  
તમારી કમણે વળવા દો. આ સ્થિતિમાં ત્રણ સેકંડ રહો. પાછા પૂર્વ સ્થિતિમાં આવો.  
આ કસરત પાંચ વાર કરો.



## FROM THE MAKERS OF




Regards,

**Meyer Vitabiotics**

## ઇન્ડિપુરી હોસ્પિટલ

નોંધ ના નાનીનાની, ગુજરાત.  
ફોન: ૭૨૭૮૩૪૦/૭૨૭૮૩૪૧  
મોબાઇલ: ૯૮૨૫૮૫૫૫૫૫૫૫૫૫૫૫૫  
મેઈનાર્થ: ૭૨૭૮૩૪૦૦૦૦

### ગરદન ને ઉપયોગી કસરતો



### -ઓટલું ખાસ દ્વાનમાં રાખો :-

- ગરદન દુઃખે છે.... અને વાયમાં દુખાવો આવે છે.
- ઓશીકું રાખવું નહીં
- નીચી ડક કરીને કામ કરવું નહીં
- વજન ઉપાડવું નહીં
- સમજાવેલી કસરત કરવી.

- દરેક કસરત ૫/૧૦/૧૫/૨૦/૨૫ વખત કરવી.
- દરેક વખતે ૫ થી ૧૦ ગણો અને પાછું કરો.
- દિવસના ર/૩/૪/૫ વખત કસરત કરવી.